

16th Meeting of the Working Mechanism for Consultation & Coordination on India-China Border Affairs

July 10, 2020

ભારત ચીન-સીમા બાબતો પર પરામર્શ અને સમન્વય માટે કાર્ય પ્રણાલીની 16મી બેઠક

જુલાઈ 10, 2020

ભારત-ચીન સીમા બાબતો (ડબલ્યૂએમસીસી) પર પરામર્શ અને સમન્વય માટે કાર્ય પ્રણાલીની 16મી બેઠક 10 જુલાઈ 2020 નાં રોજ યોજવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયનાં પૂર્વ એશિયા બાબતોનાં સંયુક્ત સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીની વિદેશ મંત્રાલયનાં સીમા અને સમુદ્રી વિભાગનાં મહાનિદેશક દ્વારા કરવામાં આવ્યું હતું.

2. બન્ને પક્ષોએ બન્ને વિદેશ મંત્રીઓ વચ્ચે 17મી જૂન 2020 નાં રોજ થયેલી સમજૂતિ અને બે વિશેષ પ્રતિનિધિઓ (એસઆર) વચ્ચે 5 જુલાઈ 2020 નાં રોજ તેઓ વચ્ચે થયેલી ટેલીફોન વાતચીત દરમિયાન થયેલી સમજૂતિ યાદ કરી હતી, અનેફરીથી પુષ્ટિ કરી હતી કે દ્વિપક્ષીય સમજૂતિઓ અને પ્રોટોકોલ અનુસાર બન્ને પક્ષો સીમા ક્ષેત્રોમાં સંપૂર્ણ શાંતિ અને સુલેહ પુનઃસ્થાપિત કરવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સૈનિકો સંપૂર્ણ રીતે દૂર કરવાનું અને ભારત-ચીન સીમા ક્ષેત્રોપર તણાવ ઘટાડવાનું સુનિશ્ચિત કરશે. તેઓ તે બાબત પર પણ સંમત થયા હતા કે દ્વિપક્ષીય સંબંધોનાં એકંદર વિકાસ માટે સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ અને સુલેહ જાળવવા અતિ મહત્વપૂર્ણ છે.

3. તેઓએ એલએસીનાં પશ્ચિમ ક્ષેત્રમાં ચાલું તણાવ ઘટાડવાની પ્રક્રિયામાં થયેલી પ્રગતિ સહિત ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં રહેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓ સંમત થયા હતા કે સીનિયર કમાન્ડરો વચ્ચે થયેલી સમજૂતિઓનું બન્ને પક્ષો નિષ્ઠાપૂર્વક અમલીકરણ કરે તે આવશ્યક હતું. બન્ને એસઆર દ્વારા સંમત થયા અનુસાર, સમયસર રીતે સંપૂર્ણ સૈન્ય દૂર કરવાનું અને તણાવ ઘટાડવાનું સુનિશ્ચિત કરવા માટે આગળનાં પગલાઓની ચર્ચા કરવા માટે સીનિયર કમાન્ડરોજલ્દીથી મળશે.

4. બન્ને પક્ષો પરિસ્થિતિનાં વહેલું નિરાકરણ લાવવાનું સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય સ્તર પર વાતચીત ચાલું રાખવા માટે પણ સંમત થયા હતા. આ સંદર્ભમાં તેઓએ નજીકનાં ભવિષ્યમાં ડબલ્યૂએમસીસીની બીજી મીટિંગ યોજવા માટે સંમત થયા હતા.

નવી દિલ્હી

જુલાઇ 10, 2020

DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.